### Sun Pharmaceutical Industries Ltd.

Sun House, Plot No. 201 B/1,

Western Express Highway, Goregaon (E), Mumbai – 400 063, Maharashtra, INDIA.

Tel.: (91-22) 4324 4324 Fax: (91-22) 4324 4343 Website: www.sunpharma.com CIN: L24230GJ1993PLC019050



#### March 25, 2020

**National Stock Exchange of India Limited** 

Exchange Plaza, Bandra Kurla Complex, Bandra (East), Mumbai – 400 051,

Maharashtra, India.

Scrip Symbol: SUNPHARMA

**BSE Limited** 

1st Floor, P.J.Towers,

Dalal Street, Mumbai – 400 001,

Maharashtra, India.

**Scrip Code: 524715** 

Dear Sir/Madam,

Subject: Submission of Corrigendum to Public Announcement issued in relation to the buy-back of equity shares by Sun Pharmaceutical Industries Limited ("Company")

With reference to captioned subject, the Public Announcement dated March 18, 2020 ("PA") in relation to buy-back was filed with your good office on March 19, 2020. The Company has issued Corrigendum to PA dated March 24, 2020.

The said Corrigendum has been published in the following newspapers on March 25, 2020:

Name of Newspaper	Language	Editions
Business Standard	English	All editions except Kolkata, Mumbai and Ahmedabad edition as
		the publication house at these locations were closed due to
		lockdown pursuant to COVID-19 pandemic.
Business Standard	Hindi	All editions except Kolkata and Mumbai edition as the
		publication house at these locations were closed due to
		lockdown pursuant to COVID-19 pandemic.
Loksatta-Jansatta	Gujarati	Vadodara edition

Further, it is expected that the Corrigendum will be published in the next available publication of the aforesaid editions that were not be published due to COVID-19 pandemic.

In this regard, we are pleased to submit the soft copies of Corrigendum as appearing in the e-papers namely Business Standard - (English), Business Standard - (Hindi) and Loksatta-Jansatta – (Gujarati) Regional Language containing the said Corrigendum.

Kindly receive the same in order and take the same on record.

Thanking you, Yours faithfully,

For Sun Pharmaceutical Industries Limited

Sd/-

Ashok I. Bhuta Compliance Officer

Enclosed: As stated above.

Note: In view of the lockdown due to COVID-19 pandemic, we are submitting unsigned letter.

Registered Office: SPARC, Tandalja, Vadodara – 390 012, Gujarat, INDIA.

Reaching People. Touching Lives.



वाणिज्यिक पत्र के जरिये रकम जुटाने पर विचार के लिए बोर्ड बैठक 27 मार्च को



यूएस एसईसी ने व्हिसलब्लोअर मामला खत्म किया ₹ 526.70 पिछला बंद भाव ₹ 593.55 आज का बंद भाव हिंदुस्तान यूनिलीवर

ग्लेनमार्क से वीवॉश का अधिग्रहण किया

4.134.50

टीटीके प्रेस्टिज

31 मार्च तक विनिर्माण 3,984.60 45 बंद रखने का निर्णय लिया र 4,134.50 पिछला बंद भाव र 3,984.60 आज का बंद भाव

एनआईआईटी टेक्नोलॉजिज

ए समूह में सबसे अधिक चढ़ने वाला शेयर

### संक्षेप में

## कोरोना संकट : जेके टायर के अधिकारी लेंगे कम वेतन

कोरोनावायरस संकट के बीच जे.के. टायर ऐंड इंडस्टीज के निदेशक मंडल के सदस्य और वरिष्ठ अधिकारी 25 फीसदी तक कम वेतन लेंगे। कंपनी के चेयरमैन और प्रबंध निदेशक रघुपति सिंघानिया ने एक बयान में कहा. कोरोनावायरस संकट की वजह से मौजूदा वक्त में हम बिक्री और लाभ दोनों स्तर पर अभूतपूर्व संकट का सामना कर रहे हैं। उन्होंने कहा कि इस मुश्किल वक्त में सहृदयता दिखाते हुए हमारा प्रबंधन और वरिष्ठ अधिकारी आगे आए हैं और उन्होंने अपना 25 फीसदी तक कम वेतन लेने का निर्णय किया है। वेतन में यह कटौती कंपनी के वैश्विक परिचालन के अधिकारियों पर भी लाग होगी।

### एमेजॉन ने गैर-जरुरी सामान की बिक्री बंद की

एमेजॉन ने मंगलवार को कहा कि वह भारत में कम प्राथमिकता वाले उत्पादों की ऑर्डर अस्थायी तौर पर निलंबित कर रही है। ऐसे उत्पादों के लिए कंपनी अपने ग्राहकों को ऑर्डर रद्द करने का विकल्प दे रही है और उसके लिए रिफंड देने को तैयार है। सभी शहरों में लॉकडाउन के कारण एमेजॉन स्थानीय अधिकारियों के साथ काम कर रही है ताकि प्राथमिकता वाले सामान ग्राहकों के पास बिना किसी अवरोध के

# दूरसंचार फर्मों की आपात योजना तैयार

आपात योजना के जरिये कंपनी के अहम नेटवर्क ऑपरेटिंग सेंटर, कॉल सेंटर को अलग-थलग किए जाने के दौरान निपटा जा सकता है

नई दिल्ली, 24 मार्च

रसंचार कंपनियां कोविड-19 से अलग अप्रत्याशित चुनौती से जूझ रही हैं। यह संकट है जो भारतीय कंपनी जगत को इंटरनेट की अबाध सेवा मुहैया कराना क्योंकि वे घर बैठकर दफ्तर संभाल रहे हैं।

मौजूदा क्षमता पर ये चीजें उपलब्ध कराने के लिए भारती एयरटेल और वोडाफोन आइडिया ने कहा है कि स्थिति को नियंत्रण में रखने के लिए हर मुमकिन कोशिश कर रहे हैं। कंपनियों ने जरूरी जोखिम में कभी वाले प्रोटोकॉल के साथ विस्तत महामारी रिस्पांस प्लान चाल किया है, वहीं यह सुनिश्चित कर रही है कि नेटवर्क को चालू रखने के लिए मिशन किटिकल पॉसेस जारी रहे क्योंकि दूरसंचार आवश्यक सेवा है।

समझा जाता है कि एयरटेल के पास पूरी तरह से तैयार आपात योजना है, जिसके जरिये कंपनी के अहम नेटवर्क ऑपरेटिंग सेंटर, कॉल सेंटर को अलग-थलग किए जाने के दौरान निपटा जा

कंपनी ने हर लोकेशन को डिस्ट्रिब्यूटेड व वर्चुअल दोनों तरीके से परिचालित करने में सक्षम बनाया है। हर दुरसंचार की तैयारी



■कंपनियों ने जरूरी जोखिम में कमी वाले प्रोटोकॉल के साथ विस्तृत महामारी रिस्पांस प्लान चालू किया है, वहीं सुनिश्चित कर रही है कि नेटवर्क को चालू रखने के लिए मिशन क्रिटिकल प्रॉसेस जारी रहे क्योंकि दुरसंचार आवश्यक सेवा है

टीम को दो में बांटा गया है ताकि एक साइट पर कम लोग रहें और कार्यस्थल सुरक्षित बनाया जा सके।

कारगर रहे। साथ ही कंपनी ने सुरक्षित कनेक्शन के साथ कर्मचारियों को घर से कंपनी ने दूसरे लोकेशन से नेटवर्क काम करने में सक्षम बनाया है। भारती की निगरानी व प्रबंधन की प्रक्रिया शुरू की है ताकि अगर कुछ समय तक किसी एयरटेल के सीटीओ रणदीप सेखन ने कहा, एयरटेल का नेटवर्क बीसीपी मोबाइल, फिक्स्ड ब्रॉडबैंड, डीटीएच और फाइबर नेटवर्क उभरते परिदृश्य में ग्राहकों को सेवा देने के लिए पूरी तरह उन्होंने कहा, सभी ऑपरेशन ठीक तरह से चालू हैं और 80 फीसदी कर्मचारी

(बिजनेस कॉन्टिन्युटी प्लानिंग) मोड में

है और किसी आपात स्थिति में सहायत देने के लिए पूरी तरह तैयार है। हमारे

घर से काम कर रहे हैं। वोडाफोन आइडिया के प्रवक्ता ने बिजनेस स्टैंडर्ड से कहा, संकट के दौरान

अवश्यक सेवा के तौर पर दूरसंचार नेटवर्क के अबाध परिचालन के लिए हम् सरकारी निर्देश का अनुपालन कर

उन्होंने कहा, वोडाफोन आइडिया के पास काम की लचीली नीतियां हैं, जो काम के घंटे तय करने, घर से काम करने और संगठन के भीतर अलग लोकेशन से काम करने में सक्षम बनाता है। यह हमें मौजूदा स्थितियों में तेजी से प्रतिक्रिया जताने की इजाजत देता है और यह काम अपने वर्कफोर्स को वैकल्पिक तरीका अपनाने में सक्षम बनाकर होता है। हमारे ज्यादातर कर्मचारी घर से काम कर रहे हैं। कंपनी अपने सभी ऑपरेशन में विजनेस कॉन्टिन्यूटी प्लान की समीक्षा

# बीएस-४ के लिए सर्वोच्च न्यायालय से उम्मीद

ज्योति मुकुल और शैली सेठ मोहिले नई दिल्ली/मुंबई, 24 मार्च

देश भर में 1 अप्रैल से केवल नए उत्सर्जन मानदंड वाले वाहनों की बिक्री करने का निर्देश है लेकिन कोविड-19 वैश्विक महामारी के फैलने के कारण पुराने उत्सर्जन मानदंड वाले वाहनों की विक्री के लिए समय-सीमा में कोई भी विस्तार सर्वोच्च न्यायालय ही दे सकता है। एक वरिष्ठ सरकारी अधिकारी ने बिजनेस स्टैंडर्ड से कहा कि सरकार सर्वोच्च न्यायालय के निर्देशों के आधार पर ही कोई

निर्णय लेगी। वाहन डीलरों के संगठन फेडरेशन ऑफ ऑटोमोबाइल डीलर्स एसोसिएशन (फाडा) और हीरो मोटोकॉर्प एवं होंडा मोटरसाइकिल ऐंड स्कूटर्स इंडिया सहित दोपहिया विनिर्माताओं ने पिछले सप्ताह सर्वोच्च न्यायालय में एक याचिका दायर कर बीएस-4 उत्सर्जन मानदंड वाले वाहनों की उत्सन्न मानदड वाल वाहना को विस्तार देने को मांग की थी। याचिका में कहा गया है कि कोविड-19 वैश्विक महामारी फैलने के कारण वाहन कंपनियां

इस महीने के अंत तक अपने बीएस-4 वाहनों को खपाने में असमर्थ हैं । सर्वोच्च न्यायालय में इस मामले की सुनवाई अभी बाकी है। डीलरों ने उम्मीद जताई है कि उनकी याचिका पर सर्वोच्च न्यायालय में इसी सप्ताह सुनवाई होगी लेकिन सूत्रों का कहना है कि 31 मार्च से पहले सुनवाई की संभावना नहीं दिख रही है। सर्वोच्च न्यायालय ने 13 मार्च को इस वैश्विक महामारी के मद्देनजर सुनवाई को टालने और केवल आवश्यक मामलों पर ही सुनवाई करने का निर्णय लिया है।

फरवरी के आरंभ में भी न्यायाल ने इस समय-सीमा में विस्तार दिए जाने की मांग वाली एक याचिका को खारिज कर दिया था। उसके बाद फाडा ने वाहन डीलरों को 31 मार्च २०२० से पहले बीएस-4 वाहनों के स्टॉक को खपाने के लिए कहा था। दोपहिया वाहन बनाने वाली प्रमुख कंपनी बजाज ऑटो के प्रबंध निदेशक राजीव बजाज ने भारत स्टेज (बीएस)-4 वाहनों के बचे स्टॉक को इस महीने के अंत तक खपाने की समय-सीमा में कोरोनावायरस प्रकोप के महेनजर विस्तार दिए जाने की किसी भी योजना का विरोध किया है।

# SUN

## SUN PHARMACEUTICAL INDUSTRIES LIMITED

SUN PHARMACEUTICAL INDUSTRIES LIMITED
Corporate blentily humber. Liva220,11999(R-10019)
Registered Office: Sun Pharma Advanced Research Centre (SPARC),
Installa, National: 3001 CG, Guartal, India
Corporate Office: SUN House, CTS No. 201 Bit (Nestern Express Highway,
Gregopan (E), Murthal 4-400, Sil, Maherashtra, India
Phone: +91 22 4324 4324 [Fax: +91 22 4244 434]
E-mail ID: screeting@apprharma.com/ Website: www.sunpharma.com
Contact Persons: Mr. Astok I. Bhuta [Compilare Officer)
Mr. Sunl Agrina (Compilary Security & Compilareo Officer)
Mr. Sunl Agrina (Compilary Security & Compilareo Officer)
Sun Pharmaceutical Industries Limited ("Compilary") for the buy-back of Securities and Exchange Board of India (Buy-back of Securities)
Regulations, 2018.

ations, 2018.

ations, 2018.

increasing "Corrigendum" is in continuation of and should be read in retion with the public announcement diated Match 18, 2029 published on 19, 2020 in the Beauties Standard — Enjoh National Dally Alf Editions), ass Standard — Hindl National Dally Alf Editions), ass Standard — Hindl National Bolly Alf Editions), and Standard — Hindl National Dally Alf Editions), ass Standard — Hindl National Dally Alf Editions), and Standard — Hindl National Dally Alf Editions, ass Standard — Hindl National Dally Alfa Editions), ass Standard — Hindl National Dally Alfa Editions, assistant production of the Company and, the capital cando be after but of the Company and covers of Equity Shareholder's beneficial covers of Eq

oncouncement:
the Paragraph 13 billed "METHOD OF SETTLEMENT", in sub-paragraph
viz., Settlement of Demat Shares, the words "Sun Pharma-Buyback 2020at Alc" stand substituted and should be read as "Sun Pharmaceutical
stries Limited-Buyback Account".

industries Emireo-appace Account.

It is corrigendum is available on the Company's website (www.sunpharma.co id is expected to be available on the website of SEBI (www.sebi.gov.n) as well the website of Stock Exchanges (www.sebindla.com.and www.nsenidla.com.) of other information and terms of the Buy-back as disclosed in the Pubnouncement shall remain unchanned. DIRECTORS' RESPONSIBILITY STATEMENT

per Regulation 24(i)(a) of the Buy-back Regulations, the Board accepts ponsibility for the information contained in this Corrigendum and confirms that Corrigendum contains true, factual and material information and does not tain any misleafing information.

# तिथि के विस्तार के लिए सार्वजनिक सूचना डिलीशियस कोको वाटर प्राइवेट लिमिटेड - परिसमापन में

विकार के नोटिस के लिए बिकार के नोटिस के लिए II और दिवालिया संक्रिया, 2016 के तक्ष्य परिसम्पत्तियों की ई-नीलामी किकी स्व कोको बाद पढ़ाईट लिएड (परिसम्प्राण) परिसम्पत्तियों की इन्नीलामी की प्रीकी उन्हार के लिए "एक्सी को ही कक्ष्य की एक्सी की किए किए की स्वार्थ के प्राथम की एक्सी की ए

काउंटर उपायों के मद्देनजर, प्रस्तावित ई-नीलामी को अब अगली स

ओरिंटल बैंक ऑफ कॉमर्स (का का क क्रा) का काल कर्याल के की है कि महाराजा, जोश्रम तब.

पंजीकृत पांस्ट ( एडी./स्पीड पोस्ट ) ल''बीं', तहसील भीनमाल ,जिला -जालार ( राज. )-343029

का बाजा, बानावार जा , प्रह्तावर ना नामार, हर ह्याल पुत्र खेमा राम ( जमान्तदार ) | का बास ,जनी बाली, बागोरा, जिला -जालोर ( राज. )-343030

महादय,							
ं-सन्दर्भ खाता नं. 21126516000117 सोमता राम पुत्र बागा राम शाखा भीनमा (बकावा राणि का विवरण) (राणि							
(बकाचा राशि का र्	ाया राशि का विवरण)						
स्तीकृत/प्राप्त	बकाया राशि	रिकोडेर्ड ब्याज	व्युल बकावा	समय समय पर प्रभारित			
ऋण सुविधाए	दिनांक	दिनोक 29.02.2020	दिनांक	व्याव दर			
Men Aramid	29.02.2020 सक	तक	29.02.2020 सन्ह	व्याच दर			
कार लोन	W.	₩.	₩.	8.90%			
₩. 6,45,000/-	5,04,138.58	15,041.08	5,19,179.66	प्रतिवर्ष/मासिक प्रभार			
उपर्यंकत खाता पिछले कछ समय से असंतोचजनक चल रहा है तथा उक्त खाते को नियमित/समायांतित करने के लिए							
आपने कोई प्रवास नहीं किए है। अत: उक्त ऋण के संबंधे में आपने चुक की है। उपर्यंक्त चुक के मददेनतर बैंक द्वारा							
दिनोक 28-02-2020 को आपके ऋण खाते को अनर्जक आहित (NPA) में वर्गीकृत कर दिया है। इन परिस्थितियां							
में बैंक ने वितीय आस्तियों का प्रतिभृतिकरण एंय पूर्नगठन तथा प्रतिभृति हित प्रवर्तन अधिनियम 2002 की धारा 13(2)							

आस्तियाँ का विवरण	वंधककर्तां दृष्टिवंधककर्तां का नाम एंव पर		
दृष्टिकंशक MARUTI SUZUKI CAR VDI	स्रोमता राम पत्र बागा राम		
डीजल मॉडल वर्ष 11/2017	मालियों की डाणी ,भीनमाल ''बी' तहसील		
कार पंजीकृत नं. RJ46-CA-1446	भीनमाल जिला जालोर( राज. )343029		
इंजन नं. D13A0719921			
चेसिसनं MA3FHEB1S00D81025			
Fried 04 02 2020	पाधिकत अधिकारी ( राग्न सिंह रेगर		

परिशिष्ट IV देखें नियम 8(1

अधिकरात पत्त कार्यान्यन करक 19.03.2020 को पांची पर सांकेतिक आधायन कर रिपर है विशेषकः कार्यान्य के प्रधानान्तः अस्ता के प्रेस्त प्रधानान्त्र पंचानि के कहा विद्यान निक्र कर स्थानित कि प्रधानान्त्र पत्ति पत्ति पत्ति के प्राप्त कोई ये पीच पाण्ठी कर 26.70,466/ (रुपण्डी विद्यान कार्या इक्तीया स्थान पत्ति वार्षा पत्ति में क्रियानीय मात्रा 10.12.2021 के अनुसार और उस पर प्रधान के प्याप्त के प्रधान प्रधानित प्रधानान्त्र मात्रा कि प्रधान के स्थान कर स्थान के अनुसार और उस पर प्रधानकर्तिक के प्रभाव कार्यिक्तिया की प्रधा 13 की उस - प्रधा (8) के अन्यर्थन प्रधान के प्रधान कार्योग के पुण्ड कराने के शिल्प उत्पानक प्रधान की अध्यानीत किया जाता है।

अचल संपत्ति का विवरण भूमी के सभी मूखंड आवासिय प्लॉट नं.सीपी -28 मापित 126 स्के. मी., निमार्ण के साथ साथ, ब्ल क नं.सीपी में, पितमपुरा में स्थित, नई- दिल्ली-110035 और जो निम्ननुंसार परिबद्ध है:

इंडिवाबुल्स हाउसिंग फावनान्स लिमिटेर

#### बढ़ते डेटा इस्तेमाल से ऑपरेटर दबाव में से निपटने में मदद मिलेगी। इस्तेमाल में 15 से 20 प्रतिशत तक का लगभग 70 प्रतिशत है) का

9

इलाके में पहंचना संभव न हो तो यह

**रविवार** से दूरसंचार ट्रैफिक में 15 से 20 प्रतिशत तक की वद्धि नि से 20 प्रांतरात तक की कृष्टि की वह से ऑपरेटर अब सरकार से अस्थायी तौर पर तुरंत अतिरिक्त स्पेक्ट्रम की मांग कर रहे हैं। उनका कहना है कि इस तरह के प्रयास से उन्हें डेटा इस्तेमाल में हुई अप्रत्याशित वद्धि

कोरोनावायरस के तेज प्रसार की वजह से 'वर्क फॉम होम' और लोगों के 'सेल्फ क्वारंटाइन' यानी घरों में ही रहने से डेटा इस्तेमाल

में भारी इजाफा हुआ है। एक प्रमुख दूरसंचार कंपनी के वरिष्ठ अधिकारी ने कहा, 'प्रधानमंत्री द्वारा जनता कर्फ्यू का आह्वान किए जाने के बाद हमने रविवार को घने इलाकों में डेटा

• '२.---॰•• के माध्यम से प्रधान कार्यालय द्वारका, न

निविदा सचना

पंजाब नैशनल बैंक, पात्र बोलीदाताओं से "Gem के माध्यम से प्रधान कार्यालय द्वारका, ना दिल्ली में स्थापित यूपीएस के लिए 12v/200AH (156 Qty.) बैटरियों का प्रतिस्थापन हेतु ऑनलाईन बोली (तकनीकी एवं वाणिज्यिक दोनों) आमंत्रित करता है।

हुक बालाबाता ।वस्तूत आरएफथा क्रतावज स जुड़ा जानकार्य नवमर इन्-माकटफ्तर मा वैयसाइट **https://gem.gov.i**n से प्राप्त कर सकते हैं । गर्वमेंट ई-माकेंटप्तस (ज् ) पर ऑनलाइन बिंड जमा कराना अनिवार्य हैं । ऑनलाइन बिंड जमा करने वी थे थे 15.04.2020 को 16.00 बजे तक हैं ।

हादय, -सन्दर्भ खाता नं.01537011000723 अशोक कुमार सोनी पुत्र स्थ. करतार सिंह सोनी शाखा स्टेशन रोड् अ खेवरण) (राशि रूपये में प्रकार राशि रिकारेड व्यान कुल बकाम सम्प्रकृत शिताक 29.02.2020 दिगंक व्यान स्थाप ए प्रमारित स्थाप स्थाप ए प्रमारित स्थाप स्थाप ए प्रमारित स्थाप स

| 29.02.2020 तक | 1886 | 29.02.2020 तक | 11.75% | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15. | 15.

्यूपेक्स द्वारीयी वाणी देखावाएं, इस वाहित्य को तारिक से 60 दिनों के भीतर बींक की देखावारों को अपनान क्या आका विकास उरारीकात्त्वार है। स्वीद आप ऐसा करने में असफत रहते हैं तो प्रीत भूत आरिक्यों के प्रकान या राजि वस्त्री करोगा। असर इसरा चूर्चा देखावाँ ने चुकाने पर बीक निका प्रतिभूत आरिक्यों का प्रकान का पिनान्सार हैं:

ओरिंटल बैंक ऑफ कॉमर्स

जानकार के अनुसार निकट सताह डेटा ट्रैफिक 10 प्रतिशत बढ़ा। दूरसंचार विभाग (डीओटी) को भेजे पत्र में सेल्युलर ऑपरेटर्स

पंजाब नैशनल बैंक U punjab national bank

एसोसिएशन ऑफ इंडिया (सीओएआई) ने अल्पावधि और अस्थायी तौर पर 'एक्सेस एवं बैकहॉल माइक्रोवेव'दोनों के लिए अतिरिक्त स्पेक्ट्रम की मांग की है. क्योंकि दरसंचार कंपनियों को तेजी से बढ़ रही मांग को पूरा करने के लिए अपनी क्षमता बढ़ाने की जरूरत है। हालांकि सीओएआई के महानिदेषक राजन मैथ्यू का कहना है कि वे इस संबंध में अभी भी सरकार के जवाब का इंतजार कर रहे हैं। दूरसंचार संगठन ने दूरसंचार विभाग से टावरों के लिए अनमति दिए जाने की प्रक्रिया में

की वद्धि दर्ज की। उसके बाद से

इसमें लगातार इजाफा हुआ है। सीओएआई द्वारा मुहैया कराई गई

जानकारी के अनसार पिछले सप्ताह

भी तेजी लाने को कहा है। बोफा ग्लोबल रिसर्च इंडिया के अनसार, भारत में फिक्स्ड ब्रॉडबैंड की पहुंच सिर्फ 6 प्रतिशत है जिससे वर्क फ्रॉम होम के लिए दूरसंचार ट्रैफिक ( जो कुल ट्रैफिक

दबाव सेल्यलर नेटवर्क पर पडने की आशंका है। भारत में सिर्फ1.9 करोड़ फिक्स्ड ब्रॉडवैंड उपयोगकर्ता हैं जबकि कुल 3जी अगर 4जी ग्राहकों की संख्या 63 करोड़ है। विश्लेषकों का कहना है कि एयरटेल जैसी कई कंपनियां फिक्स्ड ब्रॉडबैंड के लिए नए ग्राहकों से कोई इंसटॉलेशन चार्ज या सिक्योरिटी राशि नहीं वसल रही हैं जबकि एसीटी ने अतिरिक्त शुल्क के बगैर स्पीड बढ़ाकर 300 एमबीपीएस तक कर दी है और बीएसएनएल उन ग्राहकों के लिए एक महीने तक फ्री ब्रॉडबेंड की पेशकश कर रही है जिनके पास उनकी कंपनी का लैंडलाइन कनेक्शन पहले से ही है।

हालांकि सीओएआई से मांग इस तथ्य को देखते हुए उचित दिख रही है कि अमेरिका में फेडरल कम्यनिकेशंस ने एटीऐंडटी वेरीजॉन, टी-मोबाइल और यूएस सेल्युलर को ज्यादा स्पेक्ट्रम के लिए अस्थायी तौर पहुंच मुहैया कराई है जिससे कि वे लगभग 60 दिन के लिए अपनी वायरलेस क्षमता बढा सकें।

# तमिलनाडु की कंपनियों ने रोका उत्पादन

**गिरीश बाबू** चेन्नई, 24 मार्च

तिमलनाडु सरकार के निर्देश और कई दिग्गज कंपनियों के अपना परिचालन रोकने की घोषणा के बाद राज्य की विनिर्माण कंपनियों ने भी कोरोनावायरस के प्रकोप को देखते हुए अपना कामकाज बंद करने का फैसला किया है। राज्य सरकार ने महामारी कानून, 1897 के तहत अधिसूचना जारी करके आज शाम 6 बजे से 1 अप्रैल, 2020 तक राज्य में कई तरह की पाबंदियां लगा दी हैं। टीवीएस ग्रुप की कंपनी सुंदरम फास्टनर्स और टीवीएस इलेक्ट्रॉनिक्स, मुरुगप्पा ग्रुप की ईआईडी पैरी, लक्ष्मी

मशीन वर्क्स लिमिटेड, जीएचसीएल पोन्नी जाएचसाएल, पाना शुगर्स, सुंदरम ब्रेक लाइनिंग्स लिमिटेड और एमएम फॉर्जिंग्स ने आज रोकने की घोषणा की है। ईआईडी पैरी ने एक नियामकीय सूचना में कहा कि अभी यह पता नहीं है कि कंपनी का कामकाज कब तक बंद रहेगा। कंपनी स्थिति का आकलन कर रही है। जीकरान कर रहा है। टीवीएस इलेक्ट्रॉनिक्स ने कहा कि कोविड-19 के प्रसार ने विनिर्माण संयंत्रों को कुछ संयंत्रों को कुछ कलपुर्जों की आपूर्ति प्रभावित की है और

असर पडा है।

#### सेन्ट्रल बैंक ऑफ इंडिया 🐼 Central Bank of India शाखाः आर्य नगर, देहरादून ष्ट IV (नियम 8(1))कब्जा सूचना

ऋणी / गारन्टर के नाम व पता	बंधक सम्पत्ति का विवरण	बकाया राशि	मांग नोटिस की तिथि	कब्जा व की ति
पूल रागी), पुरुष पदा: 24, धामावाजा, देहराहून- 248001, बासाविष पदा: 27, धीमती रोड, डालनावाजा, देहराहून, 2. श्रीमती कृत रागी (वीरपाइटर) पर्नी मोहन लाल, बासाविष पदा: 27, धीमती रोड, डालनावाज, देहराहून- पुरुष पदा: 24, धामावाजा, देहराहून- 248001 3, धीमती रोड, डालनावाजा, देहराहून- 24800, 1 भीमती रोड, डालनावाजा, देहराहून- 24800, 1 4, श्रीमती सुक्तानी चंत्रेच प्राणी श्री राहुल चंद्रीक, 27, धीमती रोड, डालनावाजा, देहराहून- 24800, 21	बंदन सम्मान व्यावसाधिक हुआन (श्री एवं बच्चा) मार्थ केरसत 10-45 मां मीटर (श्रूव करा) मार्थ केरसत 10-45 मां मीटर (श्रूव करा) मुनिश्चक थे 52-46 मां मीटर (श्रूव करा) मुनिश्चक थे 52-46 मार्थ मुनिश्चक थे 52-46 मार्थ केरा मुनिश्कक थे 52-46 मार्थ केरा मुनिश्चक थे 52-46 मार्थ केरा मुलिश केरा मुनिश्चक थे 52-46 मार्थ केरा मुलिश केरा मु	07.01.2020 तक + ब्याज एवं अन्य व्यय (यदि कोई भुगतान देय हो)	07.01.2020	19.03.20

## बिज़नेस स्टैंडर्ड

ाचपाणितः एउठि दिल्ली संस्करण विजनेस स्टेंडर्ड प्राइवेट शिमिटेड के लिए प्रकाशक एवं मुद्रक नंदन शिंह रावत द्वारा इंडियन एक्सप्रेस (ए.) लिमिटेड, ए-८, सेक्टर-7, बॉएड, गॉल्स बृद्ध नगर-201901 उ. प्र. से मुद्रित एवं सेस्ट हाउस, ४ समूद्र राह जन्मर मर्गा, नई दिल्ली से प्रकाशित संपादकः कैलाश नीटियाल

अस्पनाजी हैं an DEHIN/2008/27804 पाठक संपादक को lettershind@bsmall.in पर संदेश भेज सकते हैं। टेलीफोब-011-23720202-10 फैक्स 011-23720201 सन्सक्रियल और चकुंत्रेलक के लिए कृपया सम्पर्क करें.. सुजी मानसी सिंह

सुनी मानदरी दिर्पेट हेंद्र व्यवस्थार रिकेशन हिम्मान्य हैंद्र हिम्मान्य हैंद्र हैंद्र

कोई हवाई अधिभार नहीं

#### BigBasket acquires online milk delivery start-up DailyNinja

PEERZADA ABRAR Bengaluru, 24 March

Online grocery firm BigBasket on Tuesday announced 100 per cent business acquisition of online milk delivery app DailyNinja. The company did not reveal details of the finan-cial transaction. It said the ciai transaction. It said the acquisition will enable Big-Basket to consolidate its lead-ership position in the sub-scription delivery space in Bengaluru. DailyNinja currently caters

DailyNinja.currently.caters to around 110,000 customers transacting daily and will aug-ment the company's essen-tials-focused delivery service BB Daily's extensive non-milk range. Business with small traders is a growing part of BigBasker's business. DailyNinja.currently has a large network of milkman partners. "This will enable us to expand our offerines under

partners. "This will enable us to expand our offerings under BB Daily," said Hari Menon, co-founder and chief executive officer (CEO), BigBasket, adding. "Our relationship with key national brands as well as the supply chain built over the years will help us deliver a strong value proposition to them. We also aim to improve delivery more than the partners of the partners of the proposition to them. We also aim to improve delivery more delivery more delivery more than the proposition to them. delivery productivity and achieve break-even sooner

Sagar Yarnalkar, CEO and co-founder, DailyNinja, said the acquisition is a great outcome for all of its team members, shareholders, and come for all of its team mem-bers, shareholders, and founders. "When we started DailyNinja five years ago, BigBasket was the company we were hoping to emulate, and we are excited to be part of the BB (BigBasket) family now," said Yarnalkar.

# Telcos face a big challenge Firms demand higher

to keep India Inc connected spectrum allocation

Relecom companies are dealing with an unprecedented challenge, other than COVID-19 — of providing seamless internet services for a smoother work-from-home for India Inc. In a bid to do this at the available capacity, Bharti Airtel and Vodafone Idea have said they are doing everything to keep the situation under con-trol. Companies have activated troi. Companies nave activated a comprehensive pandemic response plan with requisite risk mitigation protocols for keeping networks working as telecom is an essential service.

It is learnt that Airtel has a full-fledged contingency plan in place to deal with any event.

This includes quarantining any of the company's critical net-work operating centres and call

work operating centres and can centres, among others. The company has enabled each location to operate in a dis-tributed as well as virtual way. Every team has also been broken into two in order to

reduce the number of people on a site and make the workplace a site and make the workplace safer. The company has started the process of monitoring and managing networks from dif-ferent locations in case any geography is not accessible for some time. It has also enabled work-from-home for its employ-ees through secure connections. "Airtel's networks are in busi-ness continuity plannine mode

ness continuity planning mode and are fully prepared to sup-port any exigency. Our mobile, fixed broadband, DTH and fibre networks are fully geared up to



work from home and working

from different locations across the organisation. "This has allo-wed us to respond quickly to the

wed us to respond quickly to the current situation by enabling our workforce to adopt alterna-tive forms of work. Majority of our staff members across offices are working remotely from ho-me," he said. The firm is also

reviewing its business continu

ity plans across all operations

itoring facilities, across multi-ple locations like Pune and Hyd-erabad, have been prepared for any kind of emergency evacua-tion due to the corona threat at

ion due to tne corona unea. a. any particular building," Voda-

"Adequate provision has

fone Idea said.

Our centralised network mon-

serve customers in the emerg-

serve customers in the emerging scenario" said Randeep Sekhon, chief technology offi-cer (CTO), Bharti Airtel. All operations are running smoothly with over 80 per cent employees working from home seamlessly, he said. A comprehensive pandemic response plan with requisite risk utilization protocole has been

mitigation protocols has been activated while ensuring conti-nuity of mission critical processes for keeping our networks

es for keeping our networks working ast elecom is an essential service, Sekhon added.
"We are strictly adhering to the government's instructions while operating the telecon metwork uninterruptedly as an essential service during this criss," a Vodafone Idea spokesperson told Business Standard.
Vodafone Idea has a litany of flexible working hours,

"Adequate provision has been made to provide resources, enabling work from home for technical teams working across these facilities. This is to enable undisrupted services to our cus-

nonitored through our own monitored through our own network operating centres and operations to ensure business continuity, Vodafone Idea said. The spokesperson added, "We are continuously monitoring the traffic pattern and are confident of handling the growing demand of voice and data serv-

ices during the lockdown."

On Monday, the Cellular Operators' Association of India erators' Association of India (COAI) asked the Centre to inst-ruct over-the-top players like Netflix, Amazon Prime Video and Zee 5 to take steps for easing the pressure on network infras-tructure. This pressure is due to increased demand for online video streaming amid lockdown and

COAI has also approached streaming plat-

roached streaming plat-forms, cautioning them about surge in digital use, thus straining network infrastructure of telecom oper-ators. It urged companies to take urgent steps like temporarily switching to 5D (standard defi-nition) from HD (high defini-tion) streaming reprosing high tion) streaming, removing high bandwidth- consuming adver-tisements and pop ups, and replacing them with public

announcements on awareness regarding the virus. In a letter to the telecom dep-artment secretary, COAI has said, "Due to lockdown and quarantine measures in parts of the country, a sudden surge in dem-and for online video streaming is also expected."

Telecom operators have dem-anded additional spectrum urgently on a temporary basis from the government, with traf-fic surging 15-20 per cent from

Sunday.

They say such a move will help them cope up with the unprecedented increase in data usage as a result of "work from home" and "self-quarantine" across the country

A senior executive of a telco that saw a spike in data traffic, that saw a spike in data trains, said: "We saw a huge spurt of 15-20 per cent in dense areas on Sunday, when there was a call by the Prime Minister to stay home." Last week, the traffic stood at only 10 per cent, according to feedback given by telcos to the

given by teleos to the Cellular Operators Association of India (COAI). In a letter to the Department of Telecommunications (DoT), the COAI has demanded additional spectrum for both which was a constant of the coars and backhaul microwave" for a short term, and temporarily as they used to automate the coars.

porarily as they need to aug-ment their capacity to meet the growing demand.

growing demand.

COAI Director General
Rajans Mathews, however, said
they were still waiting for a
response from the government.
The COAI has also sought
expedited permission from the
DOT for tower enhancement
from states (as they ramp up
capacity), extension in minimum roll-out timelines by six
months, and consent to go for months, and consent to go for digital acquisition of new cus-tomers instead of physical doc-



scribers.

According to BofA Global
Research, India's fixed broadband penetration is only 6 per
cent. Thus, bulk of the pressure
due to the work-from-home
traffic (around 70 per cent of

free-of-charge broadband for a month to those who have a

**APPOINTMENTS** 

भारतीय रिज़र्व बैंक सर्विसेज़ बोर्ड, मुंबई RESERVE BANK OF INDIA SERVICES BOARD, 1 Recruitment Advt. No. 3/2019-20

Name of the Post

umentation (will reduce time to on-board customers) — given the sharp rise in new subscribers.

AT&T, Verizon, T-Mobile, and US Cellular temporary access to more spectrum to enable them to increase their wireless them to increase their wireless capacity for around 6 do days. DoT, which is planning togo for a mega spectrum auction, has no shortage of airwaves in vari-ous bands from 700Mhz to 1800Mhz, besides the 5G spec-

time to the work-rimine to traffic (around 70 per cent of 1800Mitz, besides the \$5 spectotal traffic) (seepected beon the cellular network. India has only 19 million fixed broadband nusers compared to a Maysts say operators like the \$40 per cent. Capacity. Gold million (30 and operators like 46) users. Analysts altrelare not any operators like tharging for rimine for his compared to the control of the contro

capacity.
COAI has already received a monto to those who have a BSNL landline.
The demand from COAI is opsitive response from overvalid, considering that the rederal Communications commission in the US has granted before the communication of the communica

Vacancies

#### Flipkart halts new orders from Tuesday night

Flipkart will stop taking orders on its site starting from Tues-day night, according to inter-nal communication. "We want to first disable taking all orders and then start enabling orders and then start enabling categories in a sequential ma-nner, "Adarsh Menon, senior vice-president, Flipkart said. The directive follows Prime Minister Narendra Modi's late Tuesday announcement of a 21-day nationwide lockdown to contain the spr

# YouTube, Netflix, FB reduce bit rate to mitigate network congestion

Nettins said it will reduce traffic on telecom-munications networks by 25 per cent while maintaining the quality of service for users in India, while Tacebook said it will temporarily reduce bit rates for videos on Facebook and Instagram in India. YouTrube said it is tem-porarily defaulting all videos on YouTrube to standard definition.

Companies like Amazon Prime Video have will expand that change global also lowered bit rates, a measure of how much a Google spokesperson said.

You'Tube, Nefflix and Facebook are reducing bit trates for videos on their platforms in India as part of their efforts to help mitigate mobile and broadband network congestion amid the coronavirus pandemic.

Nefflix said it will reduce traffic on telecommunications networks by 25 per cent while maintaining the quality of service for users in India, while Facebook said it will temporarily art to minimise stress on the system during on the system during art to minimise stress on the system during network operators around the globe to do our part to minimise stress on the system during this unprecedented situation. Last week, we announced that wewer temporarily defaulting all videos on YouTube to standard definition in the EU. Given the global nature of this crisis, we will expand that change globally starting today.

# **Infosys gets** clean chit from **US regulator**

DEBASIS MOHAPATRA

Infosys, the country's second-largest software services exporter, has been fully clea-red by the US Securities and Exchange Commission (SEC) on the so-called 'whistle-blower' charge of last year that had alleged wrongdoing by the top

alleged wrongdoing by the top management.
"The company received a notification that the SEC has concluded its investigation and the company does not anticipate any further action by the SEC on this matter," it told the stock exchanges. The firm has also responded to all the inquiers received from the Indian regulatory authorities and will continue to cooperate (on) any additional requests." In late October 2019, a 'whistle-blower' letter went public. It alleged the company's chief executive and finance head were guilty of inflatence had were guilty of such as the content of the conten

nce head were guilty of inflat nce nead were guinty or innat-ing the growth numbers through accounting irregular-ities. Infosys' audit committee had the charge investigated and concluded this January that the allegations had no fac-tual basis

that the allegations had no fac-tual basis.
"We are comfortable that we have had a very thorough and comprehensive investiga-tion, which will put us in good tion, which will put us figood stead when we engage with them (SEC)," Chairman Nan-dan Nilekani had said afterthe internal investigation found no wrongdoing. After the SEC okay, the shares of Infosys surged 14 per cent to close at \$600 at the National Stock Evabance.

Exchange.

"Definitely, there was an overthe stock, which



DOE SUICE III	•
	620
	593.55 1.600
	580
A CONTRACTOR OF THE PERSON OF	560
1.4	540
<del>- 526.70</del>	
Mar 23.'20	Mar 24.'20

term concerns over coron-avirus, the company will post industry-leading growth num-bers once this issue settles down," said Sanjeev Hota, head of research at Mumbai-based brokerage Sharekhan. He, however, said that as with its peers, the Bengaluru-headquartered firm is likely to see delays in signings of large deats. Apart from fall in dis-cretionary seeming by diens.

cretionary spending by clients, owing to the global virus

spread.
The information technology industry is staring at a demand slowdown. Many developed countries, including America, have started to see establishments shutting do wn, to ensure social distanc-ing to fight the virus' spread. As a result, reports suggest, deal signings worth \$3-4 billion have been deferred in this month alone.

# SUN

For all other details such as eligibility criteria, reservation of vacancies, scheme selection, submission of on-line application and other instructions, please refer the detailed advertisement to be published on the flash is website (www.br.b.) and in March 27, 2020. Candidates can apply for these posts only by online mit through the Bank's website.

Website Link Open - for online Registration of Applications and Payment of Feey Intimation Charges

NOTE: Corrigendum, if any, issued on the above advertisement, will be publisher only on the Bank's website

"Don't get cheated by E-mails/SMSs/Calls promising you money"

oank s weusne. on of this advertisement will be available in Dainik Bhaskar, Dain sthan Patrika & Navihharat Times)

### SUN PHARMACEUTICAL INDUSTRIES LIMITED

SUN PHARMACEUTICAL INDUSTRIES LIMITED Corporate Identify Number: 12/220/31998/P.C019989 Registered Offices Sun Pharma Abanaced Research Carteria (SPARC), Corporate Offices: SUN House, CTS No. 201 Bit. Western Express Holyway, Grospoo, Clif. (Murchia -4 Ood), Alberharshin, Sun Phone: +91 22 4324 4334 [Fax: +91 22 4324 4343] E-mail ID: screding@unpharma.com/ Mebalte: www.sunpharma.com/ Contact Persons: Mr. Ashok I. Bhula (Complaince Officer) Mr. Sun Hapran (Company) Secretary & Complaince Officer) Mr. Sun Hapran (Company) Secretary & Complaince Officer) or the sunbarracedetal Industries: Lumited ("Company") for the buy-back of secretifies and Exchange Board of India (Buy-back of Securities) legulations, 2018.

oh 13 titled "METHOD OF SETTLEMENT".

For and on behalf of the Board of Directors of Sun Pharmaceutical Industriae Limited

Date: March 24, 2020 Place: Mumbai

# Hotel owners consider salary cuts

SHALLY SETH MOHILE

Hotel owners may be forced to go for steep salary cuts at the top and senior management levels amid lockdowns in some cities and low single-digit occupancy in sever-

With no immediate end in sight, most of them are preparing for an unprece-dented crisis in their busi-nesses. For hotels (in all seg-ments), while domestic business travellers form 76business travellers form 76-77 per cent of their cus-tomers, foreigners' share is close to 23-24 per cent. Following the outbreak and a rapid increase in corona rapid increase in coron-avirus cases, occupancy at hotels across the country have seen a 40 per cent drop year-on-year (YoY) for the current month and cancella-tions are at an all-time high, according to ICPA action. cording to ICRA esti-

ttes. The credit rating agency

The credit rating agency has downgraded the outlook on the hospitality sector to negative from stable. Unable to take the losses, some like Ferns Horle & Resorts have already decided to bite the bullet on salary cuts. "From April onwards, we will have to look at salary cuts. We will have to look at salary cuts. We will start with the top management level, with pay cuts of 50 per cent, going down to the manager level. We will not touch the lower staff level," said Sushail Kannanpilly, chief operating officer at Ferns Hotels & Resorts. Except for three Resorts. Except for three properties in Mumbai, which are being used as quarantine centres, Ferns' 18 hotels are shut, said Kannampilly, adding that



ore. ICRA expects some co rection in room rates in the

months ahead, but it would

months ahead, but it would be lower than the occupancy rate correction. Others are also bearish in their outlook. India Ratings estimates the occupancy at mid-scale and two-star hotels to fall to 30 per cent-40 per cent, and that of four-star hotels and above categories to 20 to 25 per cent for three months, besinnine March.

per cent for three months, beginning March. This slowdown comes at a time when hotels usually enjoy peak season occupan-cy because of vacations and weddings, before the onset of the monsoons. Hence, any disruption in operations is likely to substantially impact the full-year onerat-

is likely to substantially impact the full-year operating performance of hotel companies.

Sanjay Sethi, MD and CEO at Chalet Hotels, said though Chalet is not looking at job or salary cuts as of now, "everyone will have to pitch in when the time comes." The owner developments of the owner.

comes". The owner, develop

Hyderabad, and Pune — too suffered a severe knock in terms of occupancy. "On the business side, a

few rental assets we have under Chalet are helping.

That mitigates the risks for us. We are doing everything we can to pare fixed and variable costs. Employee salary is the last thing we will touch. Our employee-to-

room ratio has always been very efficient," said Sethi. Vineet Verma, executive

Vineet Verma, executive director of brigade the assets of brands, including Sheaton Grand, Four Points, and Holday Inn, which was trained to the agenda now, if the situation persists, the company will have to exercise that option. "We do not want to cut salaries at this stage and lay off people as such knee-jerk moves don't help," said Verma.

All Brigade Hospitality's properties are operating at

occupancy at some of its

properties are down to single digits. Verma said if the cur-

rent cost-containment mov es do not help, Brigade will have to shut some of its

Ferns Hotels to cut salaries of

next month Companies with high debts more vulnerable, say analysts
 Hotel occupancy across

the country is down ercent YoY

■ ICRA downgrades the hospitality sector outlook to negative from stable

hotels temporarily. Servicing the debt on its book is anoth-er challenge for Brigade. "We are working on a war-footing to see how we can handle

to see how we can handle that," said Verma. Archana Gude, an ana-lyst at IDBI Capital, said: "While the entire sector will see the impact of the current situation, firms with high leverage would be under more earnings pressure." Thus, any extension to service debt obligations, as many industry/market

many industry/market experts expect, will give some relief to the sector, she

said.
The hotel industry body
in a letter to Prime Minister
Narendra Modi last week
had sought relief. Nakul
Anand, executive directorITC Hotels & chairman, ITC Hotels & chairman, Federation of Associations in Indian Tourism & Hospitality, sought his help in several issues, including possible bankruptices and mass unemployment, and assed for relaxation of certain norms pertaining to the sector's business.

As much as 70 per cent out of a total estimated workforce of \$S million (direct and indirect) may be left unemployed.

# NTPC Limited (A Govt. of India Enterprise)

CORPORATE ENGINEERING DIVISION, NOIDA

CORRIGENDUM: FOR EXTENSION OF EXPRESSION OF INTEREST (EOI)

Leading the Power Sector

કૂડ તેલમાં સેંકડા વધ્યા : કપાસના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો : સીપીઓ, મેન્થા તેલ સુધર્યા : પ્રથમ સત્રમાં રૂ.૧૫૯૮૮,૪૨ કરોડનું ટર્નઓવર

# સોનાના વાયદાના ભાવમાં રૂ.૭૪૨, ચાંદીમાં રૂ.૨,૦૭૧નો ઉછાળ

વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૩૧૭૭૨૨ સોદામાં રૂ.૧૫૭૯૮.૪૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓનો હિસ્સો 3.૧૪૪૮૭.૫૧ કરોડનો અને રૂ.૧૪૪૮૭.૫૧ કરાડના અન ઓપાન્સનો હિસ્સો રૂ.૧૩૧૦.૯૧ કરોડનો રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૭૪૨ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૨,૦૭૧નો ઝડપી ઉછાળો આવ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં સેંકડા વધી ચરલ ગેસ પણ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાના ભાવમાં પ્રત્યાધાતી સધારો હતો. જ્યારે કોટનમાં સુધારો હતો, જ્યારે કોટનમાં નરમાઈની આગેકૂચ રહી વાયદા વધુ ઘટ્યા હતા. સીપીઓ અને

વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૫૩૪૬૧ સોદાઓમાં १५३४६१

રૂ.૯૧૦૯.૩૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૧૮૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૧૮૪ અને નીચામાં રૂ.૩૯૯૨૯ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૪૨ વધીને રૂ.૪૧૯૦૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮૮ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૪૩૫૧ અને ગોલ્ડ પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૦૨૬ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૦ વધીને બંધમાં રૂ. ૪૧૯૫૭ ના ભાવ રહ્યા

ખૂલી, ઊપરમાં રૂ.૪૦૭૨૨ અને નીચામાં રૂ.૩૭૯૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૭૧ વધીને રૂ.૩૯૯૮૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૨૧૧૫ વધીને રૂ.૪૦૦૫૩ અને ચાંદી-માઈકો એપ્રિલ રૂ.૧૯૪૩ વધીને રૂ.૪૦૩૬૫ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં ટમાં કુલ સોદાઓમાં 114390 રૂ.૩૨૯૧.૨૦ કરોડનો ધંધો થયો રૂ. ૩૨૯૧. ૨૦ કરાડના વધા થવા હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૮૮૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૮૨ અને નીચામાં રૂ.૧૮૮૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૭ વધીને રૂ.૧૯૫૧ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં પ૪૪૧ સોદાઓમાં કુલ રૂ.૪૭૯.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન વાપડા 10 સાનકાઠ રૂ.૨ કે રાખવા : જોધમાં રૂ.૪૧૯૫૭ ના ભાવ રહ્યા માર્ચ વાઘકો ગાંતેડીઠીઠ રૂ.૧૬૫૦૦ હતા. ચાંઠીના વાયઠાઓમાં ચાંઠી નીચામાં રૂ.૧૫૬૦ અને મે કોન્ટ્રેક્ટ કિલોઠીઠ રૂ.૩૮૨૦૮ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને



3.૧૬૨૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. દૃ દૃ પ. ૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪. દૃ વધીને બંધમાં રૂ. ૧૯૭.૧ ના ભાવ હતા, જ્યારે એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૨૦૫૩ ખૂલી, અંતે રૂ.૭૪ ઘટીને 3.૨૦૪૨.૪ થયો હતો. મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૧૧૦૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૭૫.૬ અને નીચામાં રૂ.૧૧૦૫.૫ રહી, અંતે રૂ.૧૧૭૪.૫ બંધ રહ્યો હતો.

કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯૨૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૪ અને નીચામાં રૂ.૯૧૬ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭.૫૦ વધીને રૂ.૯૫૦.૫ ના સ્તરે બંધ રહ્યો હતો વાયદાઓમાં કામકાજની દર્ષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૪૧૨૯૨

કરોડનાં ૨૧૪૮૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૧૩ સોદાઓમાં રૂ.૧૧૪.૪૫ કરોડનાં ૧૭૪૮૦ ટન, એલચીમાં ૨ સોદાઓમાં રૂ.૪.૦૮ લાખનાં ૦.૨ ટન, મેન્થા માં ૨૯૨ સોદાઓમાં રૂ.૧૭.૨૫ કરોડનાં ૧૫૭.૩૨ ટન. કપાસમાં ૮૧ સોદાઓમાં રૂ.૧.૬૫ કરોડનાં ૩૫૨ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૪૮૭.૭૨૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૨૨૮.૬૫૬ ટન, કૂડ તેલમાં ૨૦૯૭૬ બેરલ્સ, કોટનમાં ૨૧૧૧૫૦ ગાંસડી, સીપીઓમાં ૮૭૭૪૦ટન, એલચીમાં સોદાઓમાં કુલ રૂ. દ૧૨૯.૫૫ કરોડ ની કીમતનાં ૧૪૭૬૭.૭૮૭ કિલો. ચાંદીના વિવિધ વાયદાઓમાં દ.૮ ટન. મેન્યા તેલમાં ૨૩૯.૭૬

3.2436.62

કુલ રૂ.૨૯૭૯.૮૦ કરોડ ની કીમતનાં ૭૫૨.૭૮૨ ટન, કૂડ તેલમાં ૮૩૫૨૨ સોદાઓમાં કુલ ર.૧૩૧૦.૯૧ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૧૧.૯૮ કરોડ નું કરોડનાં ૧૩૦૩૮૫૦૦ બેરલ્સ, કોટનમાં રહ્યું હતું. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૬૩.૦૨ ટકાનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો ૩૮૫૩ સોદાઓમાં રૂ.૩૪૫.૮૫ ૩૬.૯૮ ટકાનો હતો. ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૪.૫ અને નીચામાં રૂ.૫૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૩૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦ ખૂલી, ઊપરમાં ૩.૧૦૮ અને નીચામાં ૩.૩૫ રહી . યથમ સત્રનાં અંતે રૂ.પપ.પ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટેક્ટોમાં

કિલોદીઠ રૂ.૨૬૮૦ ખૂલી, ઊપરેમાં રૂ.૩૨૫૮ અને નીચામાં રૂ.૨૨૫૦ રહી,પ્રથમ્ સત્રનાં અંતે રૂ.૩૧૭૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૧૦.પ્ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૦ અને નીચામાં રૂ.૭૧૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૫૨.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. દર ખૂલી, ઊપરમાં રૂ. દ૪.૯ અને નીચામાં રૂ. પદ. ૧ રહી પ્રથમ સત્રનાં પાયામાં રૂ. પદ.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. દ૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૧૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૦ ખુલી, ઊપરમાં રૂ.૧૪૮.૪ અને નીચામાં રૂ.૧૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૭.૨

શેરબજારમાં તેજાનો માહોલ : નિક્ટી ૨.૫૧ ટકાના વધારા સાથે ७૮૦૧ પર બંધ

# સેન્સેક્સ ૬૯૩ ઍક વધી ૨૬,૬૭૪ની સપાટીએ પહોચ્યો

# ડોલરની સરખામણીએ રૂપિયો હ્ર. ૧૪ પર ખુલ્યો અને હ્રક. ૦૯ સુધી મજબૂત થયો

મુંબઇ,તા.૨૪ શેરબજાર મંગળવારે ૧૪૧૪ અંકના વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ ૫.૫૮ ટકા કે ૧૪૫૦.૭૧ અંક અને નિક્ટી ૪.૯૧ ટકા કે ૩૭૩.૩૫ અંક વધી ખુલ્યો હતો. શરૂઆતની ૪૫ મિનિટ બાદ શરૂઆતની ૪૫ મિનિટ બાદ બજારમાં થોડો વધારો-ઘટાડો શરૂ થઈ ગયો હતો. ૩૫ મિનિટ બાદ થઈ ગયાં હતા. ૩૫ ત્યા ... બજાર ફરીથી ઉપર વધવા લાગ્યું હતું, જે બજાર બંધ થવા સુધી ... ગે-ગેક્સે ૧૯૨.૭૯ અંક ર.૬૭ ટકાના વધારાની સાથે ૨૬૬૭૪.૦૩ પર અને નિફ્ટીએ ૧૯૦.૮૦ અંક કે ૨.૫૧ ટકાના વધારાની સાથે ૭૮૦૧.૦૫ પર કારોબાર ખત્મ કર્યો હતો. આ



અંતમાં સેન્સેક્સ ૩૯૩૪.૭૨ અંક ઘટીને ૨૫૯૮૧.૨૪ પર અને નિફ્ટી ૧૧૩૫.૨૦ અંક ઘટીને ૭,૬૧૦.૨૫ પર બંધ થયા હતા. આ સેન્સેક્સના ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો છે. ડોલરની સરખામણીએ રૂપિયો મંગળવારે ૭૬.૧૪૫૨ ખુલ્યો રિઝર્વ બેક્રે ત્યાંના બજારમાં કેશ

અને ૭૬.૦૯ સુધી મજબુત થયો. સોમવારે ૭૬.૨૯ના રેકોર્ડ નીચલા સ્તર પર બંધ થયો હતો. જ્યારે એશિયાઈ બજારોમાં મજબૂતાઈ આવવાથી ભારતીય બજારોને સારા સંકેત મળ્યા. અમેરિકાની ફેડરલ

કારોબાર બે કલાકની અંદર ડાઉ જોન્સ ७७७ અંકના ઘટાડા સાથે ૧૮૩૯૬ પર પહોંચ્ચો હતો

वधाञ्चाना हिपाय धर्मा हरे नेना પગલે એશિયાઈ બજારોમાં તેજી આવી છે. શુક્રવારે ઘટાડા સાથે બંધ થયેલા અમેરિકાના બજારો સોમવારે પણ ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ૩.૦૪ ટકા કે ૫૮૨.૦૫ અંક ઘટીને ૧૮૫૯૧.૯૦ પર બંધ થયા હતા. આ રીતે નેસ્ડેકમાં ૦.૨૭ ટકા અને એસએન્ડપીમાં ૨.૯૩ ટકા ઘટાડો આવ્યો હતો. નેસ્ડેક ૧૮.૮૪ અંક નીચે ૬૮૬૦.૬૭ ૫૨ બંધ થયો હતો. એસએન્ડપી ૬૭.૫૨ અંક ઘટીને ૨૨૩૭.૪૦ ૫૨ પહોંચ્યો. સોમવારે ડાઉજોન્સ ૩૧૭ અંક ઘટીને ખુલ્યો હતો. આ રીતે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક રાત અમારકાના બાજા બજાર નન્ડક કંપોઝિટ ૨૫ અંક અને એસએન્ડપી ૩૨ અંક ઘટીને ખુલ્યા હતા. બજાર ખુલતા સમયે ડાઉ જોન્સ ૧૮૮૫૬, નેસ્ડેક ૬૮૫૩ અને એસએન્ડપી ૨૨૭૨ પર કારોબાર કરી રહ્યાં હતા. કારોબાર બે કલાકની અંદર ૯ વાગે રાતે(ભારતીય સમય મુજબ) ડાઉ જોન્સ ૭૭૭ અંકના ઘટાડા સાથે

#### ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી ભારતના ૫૦ અબજ ડોલર બચ્યા!

ન્યુ દિલ્હી,તા.૨૪

ન્યું દબ્લ,તા.૨૪ કોરાનાના કહેરના કારણે ઈક્રોનોમીને જબ્બર ફટકો વાગ્યો છેઆ સંજોગોમાં ભારત માટે કોરોના એક રીતે રાહત પણ લઈને આવ્યો છે. નીતિ આયોગના પૂર્વાધ્યક્ષ અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર અરવિંદ પાનગઢિયાનુ કહેવુ છે કે, કોરોનાના કારણે કડ ઓઈલના કોરોનાના કારણે કુંડ ઓઈલના ભાવમાં ૩૦ ટકા જેટલો વૈશ્વિક ઘટાડો થઈ ચુક્યો છે.ભારત કુડ ઓઈલનુ મોટુ આયાતકાર છે. ઓઈલ પ્રાઈસમાં ૧૦ ડોલરનો ઘટાડો થાય તો ભારતને ૧૫ અબજ ડોલરનો કાયદો થાય છે. એ હિસાબે જોવામાં આવે તો ભારતને અત્યાર સુધીમાં ૫૦ અબજનો ફાયદો થયો છે. કારણકે કુડ ઓઈલના ભાવ ૬૫ ડોલરથી ગગડીને ૩૦ ડોલર પર આવી ચૂક્યા છે. સરકારને તેના કારણે વધારાના ખર્ચ માટે ખાસી મોટી રકમ મળી શકે છે.જેના કારણે સરકાર ફિસ્કાલ ડેફિસિટ ૩.૫ ટકાના ટાર્ગેટની અંદર રાખી શકે છે

# જીડીપીનો અંદાજ ઘટાડીને માત્ર ૪ ટકા કર્યો

ન્યુ દિલ્હી,તા.૨૪ કોરોનાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ઝટકો લાગી શકે છે. હવે બ્રોકરેજ કંપની યુબીએસ ઈન્ડિયાએ નાળાકીય વર્ષ ૨૦૨૦-ર ૧ માટે ભારતની આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘણો ઘટાડો કર્યો છે. યુબીએસે કહ્યુ કે આ દરમિયાન મારતમાં માત્ર ૪ ટકા ગ્રોથ રેટ પ્રાપ્ત

યુબીએસે અગાઉ ભારતના રિયલ જીડીપીમાં વધારો પ.૧ ટકા રહેવાનું અનુમાન વર્તાવ્યુ હતુ. અગાઉ એસએન્ડપી, ફિચ અને મડીઝ જેવી રેટિંગ એજન્સીઓ પણ મારતના જીડીપી ગ્રોથ અનુમાનને ઘણ ઘટાડી ચુકી છે.

ઘણુ ઘટાડા ચૂકા છ. યુબીએસ સિક્ચોરિટીએ એક રિપોર્ટમાં કહ્યુ કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતના ઘરેલ ઉત્પાદનનો વધારો દર ૪.૮ ટકા

કોરોનાથી ભારતીય અર્થવ્યવસ્થાને અસર

યુબીએસએ ૨૦૨૦-૨૧ માટે ભારતના



રહેવાનું અનુમાન છે. આવનારા નાણાકીય વર્ષમાં ભારતની રિયલ જીડીપી વૃદ્ધિ દર વધુ સુસ્ત થઈને ૪

ટકા થઈ શકે છે. અગાઉ ૨૦૨૦-૨૧ માટે જીડીપી વૃદ્ધિને પોતાના અનુમાનને પહેલાના દ.પ ટકાથી ઘટાડીને પ.૨ ટકા કરી દેવાયો છે. કોરોનાના કારણે મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ જીડીપી મૂંગ્રેઝ ઇ વ્યસ્ટસ સાવસ જીડાયા બ્રોથના અનુમાનને ૨૦૨૦ના કેલેન્ડર યર માટે ઘટાડીને પ.૩ ટકા કરી દીધો છે. ફિચ રેટિંગે શુક્રવારે જ ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ૨૦૨૦-૨૧ માટે ઘટાડીને પ.૧

# કોરોનાનો રોગચાળો વિશ્વ માટે સંભવિત જોખમ બન્યો છે ત્યારે જીએસએકસી વડોદરા ખાતે કેટલાક મેન્યુફેક્ચરિંગપ્લાન્ટને બંધ કરાયા

GSFC વડોદરા, તા.૨૪

રાજ્ય સરકારના નિર્ણયોને અનુલક્ષીને નિવારક પગલાં લેવાની વિચારણા સાથે, જીએસએફસી મેનેજમેન્ટ દ્વારા તેના વડોદરા યુનિટના કેટલાક પ્લાન્ટોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમકે યુરિયા-I, એમોનિયા-III, એમોનિયમ સલ્ફેટ-I, મેલામાઇન-II, એચ.



એક્સ. ક્રિસ્ટલ્સ, એમ.ઈ.કે. ઓક્સાઇમ, ડબ્લ્યુ.એસ.એક., એસ.એ.જી., લિક્વિડ બાયો-ફર્ટીલાઇઝર તથા ટીશ્યુ કલ્ચર અને સોઇલ પરીક્ષણની પ્રયોગશાળાઓ. ફોસ્ફોરિક એસિડ અને એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ (એ.પી.એસ.) પ્લાન્ટોનું સંચાલન ૫૦% ક્ષમતા પર

બીજે મેડીકલ ખાતે કરવામાં આવશે

કરવામાં આવશે.આ ઉપરાંત, સિક્ક યુનિટ (જિલ્લા જામનગર) ખાતેન તમામ પ્લાન્ટો સંપર્ણપર્ણબંધ કરી થયા છે તેના પુનઃ પ્રારંભનો નિર્ણય ૩૧-૦૩-૨૦૨૦ ના દિવસે એકંદર પરિસ્થિતિ અને રાજ્ય સરકારની નીતિના આધારે લેવામાં આવશે.

આંધ્રપ્રદેશ સરકારે કહ્યું છે

વોશિંગ્ટન, તા.૨૪ કોરોનાવાઈરસને કારણે અમેરિકન કંપનીઓને અંદાજે પડવાનો ભય રહેલો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. અમેરિકાની ખાનગી તથા સરકારી કંપનીઓને મળીને આ તબક્કે અંદાજિત ૪ ટ્રિલિયન ડોલરની ખોટ જવાનો સંભવ છે.

આ એકદમ ભયાનક ઘટાડો છે. આ નુકસાની ઓછી કરવામાં નહીં આવે તો, તેની અસર લાંબા ગાળા સુધી ચાલુ રહેશે. કોરોનાની અસર વિશ્વભરમાં પડી રહી છે તેને ધ્યાનમાં રાખતા વિશ્વ વેપાર પર આની ૧૨ ટિલિયન હોલરની વર અત્યા ૧૨ દુદ્ધવવ ડાલરવા અસર પડવા સંભાવાના રહેલી છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આ પાર્શ્વભૂમાં અમેરિકન

કંપનીઓએ તેમના મૂડી ખર્ચમાં ૯૦૦ અબજ ડોલરનો કાપ મૂકવો પડી શકે એમ છે. જે તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટના ચાર ટકા ઉલ્લેખવામાં આવ્યું છે રાજકોષિય અથવા નાણાંકીય દરમિયાનગીરી કર્યા વગર ૪ જેટલું થવા જાય છે. મૂડી ખર્ચ ઉપરાંત અમેરિકાની કંપનીઓએ

બાયબેક્સ અને મર્જર તથા એકવિઝિશન પાછળના ખર્ચમાં eoo અબજ ડોલરનો ઘટાડો કરવાનો વારો આવી શકે છે જે તેના જીડીપીના ૩ ટકા જેટલું થવા જાય છે. આના પરિણામેં રોજગારમાં પણ કાપ મૂકવાની ફરજ પડશે. ઈક્વિટી માર્કેટસની હિલચાલ

માગ-પૂરવઠામાં વધુમાં વધુ ઘટાડો કેટલો થઈ શકે અને આ ઘટાડાને કારણે અમેરિકન કંપનીઓની આવક પર શું અસર પડી શકે તેની માહિતી મેળવીને આ અંદાજ કઢાયો હોવાનું રિપોર્ટમાં

વિશ્વભરમાં અનેક કંપનીઓ ડીકોલ્ટ થવાની પણ એક રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી

ટિલિયન ડોલરનો આંક એટલે એમેરિકાના આ વર્ષના જીડીપીમાં ૬ ટકાથી વધુનો ઘટાડો થવો એમ કહી શકાય. ૨૦૧૯ના અંતિમ સ્તરની સરખામણીએ બીજા ત્રિમાસિક ગાળામાં આથક પ્રવૃ ત્તિમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો અમે જોઈ રહ્યા છીએ એમ બ્રિજવોટર રિપોર્ટમાં જણાવાયું

બીજા ત્રિમાસિક ગ અમેરિકન કંપનીઓનો વૃદ્ધિ દર્ ૩૦ ટકા જેટલો નીચો રહેવાની પણ ધારણાં મુકાઈ રહી છે. આ કારણે મોટાભાગની કંપનીઓને

બોજ વધી શકે છે. અનેક કંપનીઓ ડીફોલ્ટ જવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમશ્યાને વિવિધ દેશની સરકારો કેવી રીતે હાથ ધરી શકે છે તેના પર બજારોના ભાવિ

કેશનું ધોવાણ થઈ જશે. આવી નિર્ભર રહેશે એમ પણ રિપોર્ટમાં સ્થિતિમાં કંપનીઓના દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થિતિનો અંદાજ મેળવીને નાણાં નીતિ હળવી કરવા જેવા પગલાં હાથ ધર્યા છે. અમેરિકામાં સપાટીએ આવી ગયો છે.



#### SUN PHARMACEUTICAL INDUSTRIES LIMITED

ગજરાતમાં...

અમદાવાદમાં અત્યાર સુધીમાં ૧૩ કેસ મળ્યા છે. માત્ર સોમવારે જ દ કેસ મળ્યાં હતા. વડોદરામાં પણ સોમવારે ૩ નવા કેસ નોંધાયા છે. બંને શહેરોમાં લોકલ ટ્રાન્સમિશનની સંખ્યા પણ વધી છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ૧૧,૧૦૮ લોકો હાલ ક્લોરન્ટાઈનમાં છે. જેમાંથી રર૪ લોકો સરકારી સ્થાનો પર અને ૧૦૮૫૦ લોકો પોતાના ઘરમાં છે. તમામ લોકોને ૧૪ દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૧૦ લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ ૧૧ હજાર ૧૦૮ લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે ૧૫૮૩ આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ૬૦૯ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આજે પર સેમ્પલ આવ્યાં છે. જેનો ટેસ્ટ

તેમણે ૧૦૪માં જરુરીયાત વિના લોકોને કોલ ન કરવા વિનંતિ કરી છે. ગઇકાલે ૨૪૨૪ કોલ આવ્યા જેણે કોવિડને લગતા સવાલો કર્યા હતા. તમામ કોલને ક્લોઝર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં એન-૯૫ માસ્ક- ૪૫૦૦૦ જેટલા ઉપલબ્ધ છે. કોરોનાના કેરને કારણે સંપૂર્ણ રાજ્યમાં ૩૧ માર્ચ સુધી સરકારે લોકડાઉન કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કર છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. લૉકડાઉનનું ચુસ્ત પાલન માટે પોલીસ ઉપરાંત એસઆરપીની દ કંપની, રેપિડ એક્શન ફોર્સની ૪ કંપની પણ રાજ્યમાં તહેનાત રહેશે પોલીસે ગુજરાતના તમામ જિલ્લાની અને રાજ્યની અન્ય રાજ્યો સાથેની બોર્ડર સીલ કરી દીધી છે.

ગાંત્રપ્રદેશ સરકાર કહ્યું છે કે વિદેશથી પાછા આવેલા લોકોની ઓળખ માટે મેડિકલની ટીમો લોકોની ઘરે ઘરે જઈને તપાસ કરશે. ત્રણ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાએ તેના ઘણા શહેરોને લોકડાઉન કર્યા છે. દેશના ૫૭૭ જિલ્લા આ દાયરામાં આવે છે. સાથે જ મહારાષ્ટ, પંજાબ, પુકચેરી અને રાજસ્થાનમાં કરુ લુકવરા અંગ રાજસ્વાનના કરવૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ અને જબલપરમાં સોમવારે અડધી રાતથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. નવા ૨૨ કેસ નોંધાવાની સાથે જો એક્ટિવ કેસ (હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી) ૪૪૬ છે. ૩૬ લોકો સાજા થઈ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલ્હીમાં લ્લા ૨૪ કલાકમાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. અહીં કોરોના વાઈરસના કુલ ૩૦ કેસ છે. જેમાંથી પાંચ દર્દી સાજા થઈ ઘરે જઈ ચૂક્યા છે. જ્યારે એક મહિલા દર્દીનું મોત થયું હતું. દિલ્હીમાં ૧૧૭ શંકાસ્પદ કેસ પણ હોસ્પિટલમાં દાખલ છે.

# ઈન્ડોનેશિયા ખાતેથી ભારતની ખાંડ માટેની માગમાં જોવાઈ રહેલો વધારો

પૂર્ણ, તા. ૨૪ કોરોનાવાઈરસને કારણે ખાંડના વૈશ્વિક ભાવ પૂર અસર પડી રહી होवा छनां ईन्सेनेशिया जानेथी ભારતની ખાંડ માટેની માગમાં થયેલા વધારાને જોતા ભારતની ખાંડની નિકાસ કરી વધશે એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને (ઈસ્મા)

જણાવ્યું હતું. વર્તમાન ખાંડ મોસમમાં ૧૫મી માર્ચ સુધીમાં ખાંડ મિલોએ ૩૦ લાખ ટન્સ ખાંડ નિકાસ માટે રવાના કરી છે એમ ઈસ્મા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું. બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ખાંડ મિલોએ અત્યારસુધી ૩૬થી ૩૭ લાખ ટન્સ ખાંડની નિકાસ માટે કરાર કર્યા છે. કોરોનાવાઈરસને કારણે હાલમાં વૈશ્વિક સ્તરે ઊભી થયેલી ગંભીર સ્થિતિએ ખાંડની

કિંમતો પર અસર કરી છે પરંતુ આ તેની ખાંડની નિકાસ વધારવાની તક અસર કામચલાઉ હશે એમ પણ ઈસ્માએ જણાવ્યું હતું.થાઈલેન્ડમાં ખાંડના ઉત્પાદનમાં થયેલા ઘટાડા તથા ઈન્ડોનેશિયાની સરકાર દ્વારા ભારત તથા અન્ય દેશો ખાતેથી ખાંડની આયાત વધારાતા ભારત માટે

ઊભી થઈ છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ભારતની ખાંડની નિકાસમાં ટૂંક સમયમાં વધારો થશે એમ ઈસ્મા દાર દાવો કરાયો છે. કોરોનાવાઈરસને કારણે મિલો ખાતેથી છેલ્લા પંદર દિવસમાં ખાંડનો ઉપાડ ઘટી ગયો છે

